

નગરપાલિકાના પદાધિકારીઓને માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની શીખ: સ્વગૌરવ માટેના પ્રયાસથી મેળવો કામ કરવાની ગતિ અને તેના દ્વારા પ્રાપ્ત કરો ઇચ્છિત પરિણામ.

તા. ૨૬-૭-૨૦૧૩, શુક્રવારના રોજ માન. મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ સર્વાંગી શહેરી વિકાસ કાર્યશિબિરમાં રાજ્યના સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ શહેરી વિકાસ સત્તામંડળના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને શહેરી વિકાસ કાર્યક્રમોને વેગવંત બનાવવા ચિંતનાત્મક દ્રષ્ટિકોણથી સહભાગી બન્યા હતાં.

માન. મુખ્ય મંત્રીશ્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને મનનીય બોધ આપીને વિચારો દ્વારા શહેરીકરણને અન્ય લોકોની માફક આહત ન માનતાં તેને સુવિધાઓમાં ગુણાત્મક સુધારાના મંથન માટેનો અવસર માનીને પડકાર ઝીલી લેવા જણાવ્યું હતું.

૧૦ વર્ષ પહેલાં સમગ્ર રાજ્ય માટે શહેરી વિકાસનું બજેટ રૂ. ૧૨૭ કરોડ હતું. જેમાં ઉત્તરોત્તર વધારો કરી આજે તે. રૂ. ૫૬૦૦ કરોડ થયેલ છે. જે દ્વારા શહેરીજનો માટે સુવિધાપૂર્ણ પ્રાથમિક સગવડો તેમજ શ્રેષ્ઠતમ સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શહેરી વિકાસ વિભાગની કાર્યપદ્ધતિમાં માનનીય મુખ્ય મંત્રીશ્રીના કાર્યકાળમાં અનેક Innovative કામો જેવા મળ્યા છે. જેમાં ચીફ ઓફીસરની કોમન કેડર, હિસાબો માટે Double Entry Method, ઇ-ટેન્ડરિંગ જેવા કામોનો સમાવેશ થયો છે.

રથાનિક સ્વરાજની સંરચાઓને લોકોપયોગી કામોમાં ઝડપ લાવવા માટે પૂરતી માત્રામાં Manpower, Machine Power, Money Power અને Mobility નો ઉપયોગ કરવાની શીખ આપવામાં આવી. આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૫ દરમ્યાન રૂ. ૭૫,૦૦૦ કરોડ ખર્ચ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

રચના રિચિતિ મુજબ જ નકશા, રેકર્ડ અને તેને સંબંધિત વિગતો તૈયાર કરવા માટે માનનીય મુખ્ય મંત્રીશ્રીએ GEO Special Governance એટલે કે, “જે ઘરતી પર હોય તે જ કાગળ પર” નો નવો Innovative કન્સેપ્ટ આપ્યો.

રીયલ એસ્ટેટમાં સમગ્ર દેશમાં રોકાણ ઘટી રહ્યું છે ત્યારે ગુજરાતમાં તેનો ગ્રાહ વધી રહ્યો છે તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા રૂ. લાખ મકાનો શહેરી વિસ્તારમાં બનાવવાનો નિર્ણય એ ખૂબ જ હિંમતભર્યો નિર્ણય છે તેમ માનનીય મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું.

નગરપાલિકાઓના દરેક પદાધિકારીઓ અને અધિકારીઓએ પોતીકાપણાનો ભાવ પેદા કરી, મમત્વ દ્વારા વિકાસની કેડી ઉપર આગળ વધવા માટે નગરપાલિકાઓના જન્મ દિવસની ઉજવણી પણ કરવી જોઈએ.

કાર્યક્રમના અંતે માન. મુખ્ય મંત્રીશ્રી ૮ મહાનગરપાલિકાઓમાં અમદાવાદને રૂ. ૫૭૨.૦૭ કરોડ, સુરતને રૂ. ૪૭૯.૭૦ કરોડ, વડોદરાને રૂ. ૨૩૫.૨૪ કરોડ, રાજકોટને રૂ. ૧૬૭.૫૦, ભાવનગરને રૂ. ૧૦૬ કરોડ, જામનગરને રૂ. ૧૦૨.૬૫, જુનાગઢને રૂ. ૫૫.૧૪ કરોડ અને ગાંધીનગરને રૂ. ૩૭.૯૮ કરોડ મળીને કુલ રૂ. ૧૭૫૬.૨૮ કરોડના ચેકનું વિતરણ કર્યું.

આ ઉપરાંત ૧૫૯ નગરપાલિકાઓને રૂ. ૪૨૩.૩૦ કરોડ, ૮ શહેરી સત્તામંડળોને રૂ. ૨૩૮.૫૦ કરોડ અને ગુજરાત હાઉસીંગ બોર્ડને રૂ. ૮૫ કરોડના ચેક મળી સમગ્ર શહેરી વિસ્તારોને વિકાસ માટે એકંદરે રૂ. ૨૫૦૩.૦૮ કરોડના ચેક વિતરણ કર્યા.

સૌનો સાથ..... સૌનો વિકાસ..... જય જય ગરવી ગુજરાત....